

ત્વરિત જાહેરાત માટે

સિટીના રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાનના જાહેર માહિતી સત્રમાં હાજર રહેવા નિવાસીઓને આમંત્રણ

બ્રમ્પટન, ઓન્ટારિયો (25 સપ્ટેમ્બર 2020) – સિટી ઓફ બ્રમ્પટન તેના નિવાસીઓને તેમના પ્રથમ રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન જાહેર માહિતી સત્રમાં ગુરુવાર, ઓક્ટોબર 1 ના રોજ સાંજે 6:30 થી 8 વચ્ચે હાજર રહેવા આમંત્રણ પાઠવે છે. નિવાસીઓને કર્મચારીગણ અને કન્સલ્ટિંગ ટીમને પરિયોજના વિશે વધુ જાણકારી મેળવવાની તક મળશે જ્યાં તેઓ પોતાના અભિપ્રાયો આપી શકશે.

સત્ર ઓનલાઇન યોજાશે જેની લિંક www.brampton.ca/riverwalk પરની સભાના દિવસે જીવંત થશે.

રિવરવોક અને રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન અંગે

ડાઉનટાઉન બ્રમ્પટન ઇટોબોકોક ક્રીક ફ્લડપ્લેઇનના વિસ્તારમાં આવેલ છે. જોખમ પ્રબંધન અંગેની રાહની નીતિઓથી અત્યાર સુધી તો ત્યાં આજે જે વિકાસની માત્રા પ્રકાર સાધી શકાય તેને રૂંધતી આવી છે. પૂરના જોખમોનું નિરાકરણ અને નવી ખુલ્લી શહેરી જગ્યાઓનું સર્જન જે બ્રમ્પટનના ડાઉનટાઉન વિસ્તારને વધુ સ્વસ્થ, ટકાઉ અને સ્થિતિસ્થાપક બનાવે તેનો દ્વિમુખી ઉકેલ એટલે રિવરવોક.

રિવરવોકની કલ્પના એવી છે કે આ વિસ્તારમાં ઇટોબોકોક ખાડી એક નવા સ્વરૂપે પસાર થાય, જેની આસપાસ જાહેર સ્થળો અને ઉદ્યાનો હોય જે ઇટોબોકોક ક્રીક વેલી કોરિડોઅથી જોડાયેલ હોય. તેનાથી ડાઉનટાઉનમાં 3.6 મિલિયન ચોરસ ફુટ રહેણાક, વાણિજ્યિક અને છૂટક જગ્યા ઊભી થશે જેનાથી 23,000 રોજગાર સર્જાશે અને GDP પર \$1.4 બિલિયન જેટલો પ્રભાવ પડશે.

રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન એક ખુલ્લી જગ્યાનો માસ્ટર પ્લાન છે જે ફ્લડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખીણની લગોલગ ખુલ્લી જગ્યાની પ્રણાલિ, પરિવહન પ્રણાલિનું એકીકરણ, પરિવારણીય અને આર્થિક ટકાઉપણા, જાહેર આરોગ્યની સમસ્યાઓ અને પ્રોગ્રામિંગ તેમજ રિવરવોકની એકંદર કલ્પનાના અમલીકરણ માટેની વિભાવનાઓ વિકસાવશે.

અવતરણો

"રિવરવોક બ્રમ્પટન માટે એક પરિવર્તનક્ષમ પરિયોજના છે જેનાથી આપણા ડાઉનટાઉનની સંભાવનાઓને છૂટો દોર મળી શકશે અને એક ટકાઉ અને હરિત શહેર બનાવવાની પ્રક્રિયા ચાલુ રહી શકશે. હું નિવાસીઓને રિવરવોક પરિયોજના અને રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન વિશે વધુ જાણકારી મેળવવા માટે ઓનલાઇન જાહેર માહિતી સત્રમાં હાજર રહીને આ રોમાંચક પહેલ વિશે પોતાના વિચારો રજૂ કરવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"રિવરવોક પરિયોજના તમામ બ્રેમ્પટનવાસીઓ માટે અગત્યની છે કારણકે તે ડાઉનટાઉન બ્રેમ્પટનને ટકાઉ, સ્વસ્થ અને સ્થિતિસ્થાપક તેમજ ત્યાં નિવાસ કરતા દરેકને માટે તેમજ જેઓ આ વિસ્તારમાં કામ કરતા હોય કે મુલાકાત લેતા હોય તેમને માટે માણવાલાયક ચોક્કસપણે બની શકે તેમાં યાવીરૂપ ભૂમિકા ભજવશે. હું નિવાસીઓને રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન જાહેર માહિતી સત્રમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું તેમજ વિનંતી કરું છું કે તેમાંથી તેઓ વધુ જાણે સમજે અને પોતાના અભિપ્રાયો આપે."

પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"રિવરવોક પરિયોજના બ્રેમ્પટન માટે ઘણું બધું કરી શકે તેમ છે જેમાં સામેલ છે પૂરના જોખમને ઘટાડવું, વિકાસ સાધવો અને રોજગાર ઊભો કરવો તેમજ ડાઉનટાઉનના જાહેર સ્થળોમાં સુધારા લાવવા જેથી બધાં તે માણી શકે. રિવરવોક અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન જાહેર માહિતી સત્ર રહેવાસીઓને આ પરિવર્તનક્ષમ પરિયોજના વિશે વધુ જાણકારી મેળવવામાં સહાય કરશે અને વિસ્તાર માટે અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન કેવી રીતે આકાર લેશે તેની દોરવાણી કરશે.

-પેટ ફોર્ટિની, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 7 અને 8 અને પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટનના ઉપપ્રમુખ

અમે જે કાર્ય કરી રહ્યા છીએ તે માટે સમુદાયની પ્રવૃત્તતા અનિવાર્ય છે અને COVID-19 ની મહામારીમાં કર્મચારીગણ નિવાસીઓના પ્રતિભાવ એવી રીતે મેળવવા પ્રતિબદ્ધ છે કે જેનાથી લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન મળે. રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન જાહેર માહિતી સત્ર રહેવાસીઓને રિવરવોક પરિયોજના અને રિવરવોક એરિયા અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાન વિશે વધુ જાણકારી મેળવવાની તક પૂરી પાડશે અને પોતાના વિચારો રજૂ કરી શકશે.

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો લાદ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એન્જેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca